

B.Com. Semester - 5 (Remedial) (CBCS) Examination**March/April-2022 (NEW COURSE)****Indirect Tax Law - 1(Dse-3)****Time: 2:30 Hours****Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧	GST શું છે? તેના ફાયદાઓ શું છે?	(૨૦)
	અથવા	
પ્રશ્ન.૧	(a) પ્રત્યક્ષ અને પરોક્ષ કર	(૧૦)
	(b) ભારતમાં GSTની જરૂરિયાત	(૧૦)
પ્રશ્ન.૨	(a) GST હેઠળ પુરવઠાનો ખ્યાલ સમજાવો.	(૧૦)
	(b) GST હેઠળ પુરવઠાના અવકાશ શું છે?	(૧૦)
	અથવા	
પ્રશ્ન.૨	(a) "અવેજ સાથે અને અવેજ વિના પુરવઠો" સમજાવો.	(૧૦)
	(b) "સંયુક્ત અને મિશ્ર પુરવઠા" સમજાવો.	(૧૦)
પ્રશ્ન.૩	માલ અને સેવાઓના પુરવઠાનો સમય નક્કી કરવા માટેની જોગવાઈઓ શું છે?	(૧૫)
	અથવા	
પ્રશ્ન.૩	તમે રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ પુરવઠાનો સમય કેવી રીતે નક્કી કરશો?	
પ્રશ્ન.૪	પુરવઠાનું મૂલ્ય શું છે ઉદાહરણો સાથે ચર્ચા કરો?	(૧૫)
	અથવા	
પ્રશ્ન.૪	નીચેના શબ્દો સમજાવો:	
	(a) એજન્ટ (b) નાણાં (c) વ્યક્તિઓ	

ENGLISH VERSION

Q.1	What is GST? What are its advantages?	(20)
	OR	
Q.1	(a) Direct & Indirect Taxes	(10)
	(b) Need for GST in India	(10)
Q.2	(a) Explain the concept of supply under GST.	(10)
	(b) What are the scopes of supply under GST?	(10)
	OR	
Q.2	(a) Explain "Supply with Consideration and without consideration".	(10)
	(b) Explain "Composite and Mixed supplies".	(10)
Q.3	What are the provisions for determining time of supply of goods and services?	(15)
	OR	
Q.3	How do you ascertain the time of supply under reverse charge mechanism?	
Q.4	What is the value of supply discuss with examples?	(15)
	OR	
Q.4	Explain the following terms:	
	(a) Agent (b) Money (c) Persons	
